

(આ નીચલી ખાખદનું લખાણ જરૂર ધ્યાનથી આપું વાંચવું.)

જરથોસ્તી ધદ્મે-ક્ષતુમ પ્રમાણે

દૃષ્ટિ-એ-ખુલુ યાને માસીક માંદળીની દુર બેસવાની હાલત
હાલમાં પારસીઓ મોટે ભાગે નહીં પાળતા હોવાથી
કોમને અણુદીઠ રીતે તનની, મનની, સ્વાતની, આર્થિક
તેમજ નૈતિક ખાખદોમાં થતું ચાલુ લયંકર તુકસાન.

(સુવાવડની હાલતને પણ એ કેખ લાણુ પડે છે).

જરથોસ્તી ધદ્મે-ક્ષતુમના માનવંત બેહેશત-બહેરેહ (બેહેશતનો હીસ્સો પામનાર) ઉસ્તાદ સાહેબ બેહરામશાહુ નવરોજ શરાફે પોતાની હૈયાતી દરમ્યાન “દૃષ્ટિ-એ-ખુલુ યાને દશતાન-સુવાવડની હાલત દરમ્યાન જળવવાના અસલ જરથોસ્તી કાયદાઓ” એ નામનાં ૧૯૧૬માં કાઢેલાં ચોપાન્યા માટે ખુલાસો છીધો હતો કે આ હાશમી યાને ઘણા ખરાખ કુળીયુગના જમાનામાં જો આ દૃષ્ટિ-એ-ખુલુની પરહેજી જળવવાની સૌથી મુખારક તરીકત પણ આપણા મરદો અને બાંતુઓ છોડી દેશે, તો જરથોસ્તી ધર્મને અને પારસી કોમની હૈયાતીને મોટી આદૃતમાં લાની મુક્તવામાં તે ચીજ આગેવાન લાગ દેશે, આ દૃષ્ટિ-એ-ખુલુની જળવણી તો કોમની નીતીરીતી અને સંસારની સ્વચ્છતાધનો સૌથી અગત્યનો પાયો છે, અને એજ પાયો જે ધસી જય તો તેની પછવાડે બીજ અનેક ખાના-ખરાખી નોડાયલીજ સમજવી. આપણે જતી અનુભવથી હાલમાં બધે નેધાંચે જીએ કે આપણી કોમમાં ઘણાજ મોટા ભાગે ઓરતોએ આ ખુલુની તરીકત પાળવાનું સર્દતર છોડી દઈ પોતાનું તેમજ આપણી કોમનું અણુદીઠ રીતે ઘણું મોદું નખોદ વાળું છે, અને એવણું સાહેબની ચેતવણીને બોદેબોલ ખરી પાડી આપી છે, અને હજ વધુ પ્રમાણમાં ખરી પાડી આપશે. એવણ સાહેબની હૈયાતી દરમ્યાન નીકળેલું દૃષ્ટિ-એ-ખુલુનું સુશ્રી ચોપાન્યું ખપી જવાથી તેજ લખાણને વંધુ વીસ્તારીને અનેક શરેહ સાથે “ફ્રો-ગર્ડ” ચોપાન્યામાં મુજ નાચીને ૧૯૩૩ માં છપાવી તેજ લખાણની બીજી ૧૫૦૦ નક્કો કોમમાં સુશ્રી ફેલાવો કરી હતી, અને તે પણ ખપી જવાથી આપણી કોમના લોકોમાં આ દૃષ્ટિ-એ-ખુલુને લગતું જાન હજ ચાલુ ફેલાવો પામતું રહી ઓરતો, તેનો અને તેટલો જરૂર અમલ કરે અને પોતાને તેમજ કોમને આ ખુલુની

હાલત નહી પાળવાથી પેઢા થતી નજ્યોદ વાળનારી આકિતમાંથી અચાવે એવી મતવખ્યથી આ લખાણું પાછું સુધારા વધારા સાથે આ ચોપડીમાં છપાવ્યું છે કે જેથી તે હમેશાનું જળવાઈ રહે.

“દૃષ્ટિ” એટસે શું? તેના ૨૧ પ્રકારે.

“દૃષ્ટિ” એ અવસ્તાનો ખાસ લોગિટિક શબ્દ છે, તેનો અર્થ અશોધને લગતી તરીકો યાને પળેપળની જુંદગીમાં પાળવાના જરયોશીલ દ્વારનમાં શીઆઉલા તમામ કાયદાઓ વહેવાર રીતે નહી પાળ્યાથી અણુદીઠ તુકસાનકારક મેળેટીક ધ્વનિઓ તથા અણુદીઠ ખરાખ રોગીઓ ‘હરારત’ યાને ગરમી પામીને પોઆધને સુદ્ધમદર્શક યંત્રથી પણ નહી દેખાય એવી નાશકારક ‘હરીરી’ યાને સુક્ષમ જંતુઓનો ઉત્પન થયદો જમીદો (જર્થો) આમ અર્થ થાય છે. જે પ્રમાણે અશોધના હર ભરતબા જરયોશીલ દ્વારનમાં સમજનેલા છે, તેજ પ્રમાણે અશોધની સામે હભી થતી અસર જેને “દૃષ્ટિ” ના નામે ઓળખવામાં આવે છે, તે “દૃષ્ટિ” ના બધા મળીને મુખ્ય ૨૧ પ્રકાર જણાવવામાં આવ્યા છે, જેનાં કેટલાંક નામો જુદી જુદી યસ્તોમાં તેમજ પતેત પરોમાનીમાં આપણું મળી આવે છે, જેમાંના થોડાંક નામો આ પ્રમાણે છે:—પતેત પરોમાનીમાં જણાવેલી “દૃષ્ટિ-એ-હૃદિ” યાને “દૃષ્ટિ-એ-હૃદી” જે બીજી અધી દૃષ્ટિઓને ટેકો યાને મુજા સમાન છે, તે જીવતાં જગતાં શરીરમાંની તમામ નજીસાતો જેવી કે બાલ, નખ, હાડકાં, થુક, ઓક; લોહી, પરં, રસી, મળ-મુત્ર, વીગેરે શરીરથી છુટાં પડ્યાં પછી તેની અંદરથી નીકું જતા બદ પ્રવાહેથી ઉત્પન થતી ખરાખ અસરોને નામ આપવામાં આવ્યું છે. ખોરદાદ યશ્તમાં જણાવેલી “દૃષ્ટિ-એ-હૃદી” તથા “દૃષ્ટિ-એ-હૃદી” જે ઘણીજ નાજુક ગુણ ભાગોને લગતી બાબ્દો છે તે તથા જમ્યાદ યશ્તમાં જણાવેલી “દૃષ્ટિ-એ-પએસીશા” એવી તો ખરાખમાં ખરાખ આ ત્રણ દૃષ્ટિઓ છે કે તેની ભયાનક અસરોને લીધે આખી કોમ, દેશા, યા શેડેર એમના એમ ધરતીની અંદર યા રેલ આવવાથી ગરક થઈ જય છે.

“દૃષ્ટિ-એ સએની” એક ગામ યા દેશના લોકોના બદ આચાર વીચારો તથા રહેણુંની (જેવા કે ઝુન, ચૌરી, દગ્ગો, લોક, લાલચ, હવસ, કુપટ, જુદું વગેરે) ના વાતાવરણની અંદર બંધાયલા અણુદીઠ હરીરીના ગુઆરો યાને અણુદીઠ પડોને લીધે ઉત્પન થતી તુકસાનકારક અસરોને કહે છે, અને દેશપર મરકી, ધરતીકંપ, દુકાળ, લડાઈ, રેલ, આગ,

આકિતો વગેરે આવી પડે છે તે આ “દર્શા-એ-સમેની” ને લીધે છે. “દર્શા-એ-નસુ” તેને કહે છે કે જે તમામ સુરકાળ ચીજેમાંથી બહાર પડે છે અને જેને તેના કાયદાસર નહીં રાજ્યાથી તથા તેને અડકુયાથી એ રીતની રીમની પુરો છે : પહેલી ‘હમ-રીત’ અને બીજી ‘પત-રીત’ કરીને કહેવાય છે. ‘હમ-રીત’ રીમની એટલે કોઈઓ નસાની ચીજના સીધા સંબંધ (direct contagion) માં આવવાથી આધ્યાત્મિક ઉત્પન થયલી હોય છે અને જે આલુદગી યાને અપવિત્રાધિનું જોર બહુન રહે છે. ‘પત-રીત’ રીમની એટલે ‘હમ-રીત’ રીમની થયા પછી તે ‘હમ-રીત’ રીમન થયેલો શાખસ બીજાં કોઈને ચોક્સ પ્રમાણ સુધી અડે તો તે બીજાંની આધ્યાત્મિક ‘પત-રીત’ રીમની (Indirect pollution) લાગુ પડે છે. વળી દરેક દર્શાના બાખમાં જુદા જુદા પ્રસંગે આ ‘હમ-રીત’ અને ‘પત-રીત’ રીમનિના કાયદાઓ જુદી જુદી હં સુધી લાગુ પડે છે તેના બારીક હીસાભી કાયદાઓ વંદીદાદમાંથી સમજવાની જરૂર છે. વળી સુરકાળ માંસ, મરછી, જેવી નસાની ચીજેનો ખોરાક તરફે ઉપયોગ કર્યાથી ખરાખ મેળેટીક અસરો શરીરમાં આમેજ થદ બધી રીતે નુકશાન-કારક થદ પડી હુંખદરદોનું કારણ થદ પડે છે. “દર્શા-એ-નસુ” ની બદ અસરો અટકાવવાને ખાતરજ આપણા જુલંદ ધર્મમાં ગુંજર પામનારની લાશને સચક્વાની, તેની આગળ મોટી યશ્ટેગાન યાને ગેહસારથું કરવાની તેમજ નાની યશ્ટેગાન યાને લોય આગળ ભણતર કરવાની, તેમજ પાયદસ્ત કરવાની તથા દોષમે-નશિન કરવાની સાયનીકી કીયાઓ કરવાની ખાસ ફરમાવવામાં આવી છે, કે જે ઉચ્ચ મેળેટીજમના કાયદાઓની બારીકી હાલમાં યુરોપ, અમેરિકાના મહાન ડાક્ટરો વટીક માન્ય રાખે છે. “દર્શા-એ-ઘુલુ” યાને સંસારી લોગવટાથી તેમજ દશતાનવાળી તેમજ સુવાવડી ઓરતની હાલતથી તેમજ મરદની ગોસળની હાલતથી ઉત્પન થતી દર્શાને કહે છે. એ ઉપરાત બીજી અનેક દર્શાઓના નામો-અયુગી, મીથ દર્શા, વીના, જેહેકારી, શોધથ્ર, વ્યામણુર, ઘ્યોની, માંજન્ય, વરેન્ય, અચેશમ, વીગેરે વીગેરે નામો અવસ્તા -પહેલની-પાંડંમાં આપણું મળે છે. આ ઉપર જણાનેલી બધી દર્શા શું છે તથા તે કેમ ઉસી થવા પામે છે તે સમજ, જણી, અને જણી બેધને પછી ‘દર્શા’ થી હુર રહેતાં શીખવું અને ‘દર્શા’ ની બદ અસરને (અસરૈ-તારીકીને) ચાલુ હરદમ અશોધની ઝણાંની વૃદ્ધીમાં ફાયદાકારક અસર (અસરૈ-રોશની) માં ફેરવી નાખવું એજ દરેક જરથોશી બાનુ તેમજ ગૃહસ્થનો લુંદગીનો મુદ્રાલેખ છેવો જોઇએ. તમામ જહેરી કે ખાનગી

અનીતીઓ, જે આદમ જત પોતીકી જાતી (Sex) કે સામી જાતી તરફ કરી રહી છે, તેનું મુળન વાં દર્જા-એ-ખુલ્લની પરહેલ આયેની અજ્ઞાનતા અને ગાડેલ્યત છે.

આપણે દર્જા-એ-ખુલ્લની એક શાખા નામે મરહોની દર્જા-એ-ખુલ્લની પરહેજી યાને ગોસલપાણીનો કાયદો, શયતાન બાકી પરહેજવાની તરીકત જેને ધર્મયતમાં ધતેલામની પરહેજી કહેલી છે તે બાબદ ઉપર જણાવી ગયા છીએ. હવે બાનુઓને લગતી દર્જા-એ-ખુલ્લની પરહેજીની બાંખદ લંબાણુમાં જેઠાં. આ લંબાણુમાં દર્જા-એ-ખુલ્લ શબ્દમાં માસીક માંદગી ઉપરાંત સુવાવડની હાલતની દર્જા પણ સમાધ જય છે.

માસીક માંદગી વખતે દૂર એલાહેદાં કંય રહેલું જેઠાં?

ઓરેહની જળવણી ડરવાનાં, જે ઉત્તમ સાયન્ટીશીક ફરમાનો જરૂર્યોશી દર્શનમાં વખ્યુરે-વખ્યુરાન રમ્ભ-ગો અહૃતાના અશો સ્પીતમાન જરૂર્યોશી સાહેબે “તરીકિતો”નાં ઇપમાં આપેલાં છે, તેમાં માસીક માંદગી યાને દર્શનાની હાલત વખતે તેમજ સુવાવડની વખતે ઓરતોને એલાહેદાં દૂર રાખવાનો કાયદો એક સૌથી અગત્યનું ફરમાન છે. આ કાયદો કેટલો બધો સાયન્ટીશીક અને કુદરતાનુસાર છે તે જણવાની જરૂર છે.

જ્યારે ઓરત જેખન (Puberty)માં આવી મોટી થવા માટે છે લારે તે વખતે ચોક્સ એંયામે દર્શન ઉત્પન્ન થાય છે. તેને આપણે માસીક માંદગીની હાલત કહીએ છીએ. આ માસીક માંદગીની હાલત ઓરતને કુદરતી કાયદેન આવે છે, કારણ કે ઓરતને ઓલાદ વધારવાનું જે મહાન કાર્ય જળવવાનું છે તેને લાયકની થવા માટે આ હાલતનું ચોક્સ ઉભ્રમે આવવું તથન કુદરતી અને વાજાં છે. આવી હાલતમાં તે ઓરતનું બદન બહુજ ગરમ રહે છે અને તેનાં શરીરનાં દરેક છીદ્ધ-માંથી એક “જતની “હરારતે-ગરેવીએંબી” યાને ખોટી ગરભી મોટાં પ્રમાણુમાં બહાર નીકળતી રહે છે. અને તેને જે સારી રીતે સંભળવામાં નહીં આવે તો દર્જા-ઈ-ખુલ્લનું જેર બદુ વધી જય છે અને તે ઓરત ઉપરાંત આસપાસનાં બધાં લોકોને આ બદુ મેળેશીક પ્રવાહ બદુજ નુકસાન કરે છે. દર્જા-એ-ખુલ્લની હરારત એટલી તો જરૂર હોય છે કે એની હરારત બીજી કોઈથી ‘હરારતે-ગરેવીએંબી’ (ખોટી ગરભી) કરતાં શરીરના મુળમાંન, પેવસ થધને દરેક દરેક શરીરના ગંભેરાને યાને શરીરની અંદરના અવયવોને નિરખળ કરી નાંબે છે. આ ખોટી ગરભી ઘણું દરજનાની (of verying grades) હોય છે અને તે ઉપર જણાવેલી દરેક દરેક

દરજની વખતે તેમજ ફુખ-દરહોની વખતે અને હદખહાર ગરમ ચીજ ખાવાથી ઓછા વધતા દરજનની પેદા પડે છે. જ્યાં સુધી આ ઓટી ગરમી (હરારતે-ગરેવીઆ) એકથી ત્રણ દરજન (અસ્પંદી) સુધીની હોય છે, ત્યારે સાધારણું ભીમારીમાં યા ગંભીર ભીમારીમાં પણ તે કોઈ ખીંદાં આસપાસનાઓને હેરાન કરતી નથી, યાને ‘ચેપી’ (infectious and contagious) કહેવાતી નથી, પણ જ્યારે “હરારતે-ગરેવીઆ”ની અસ્પંદી (Velocity સુધ્યમ જેશ, પ્રમાણ) ત્રણથી વધારે ને છ સુધીની હોય છે ત્યારે તે ભીમારી ચેપી ગણ્યાય છે યાને ખીંદાને નુકસાન કરતા ગણ્યાય છે, અને જેમ જેમ અસ્પંદી ત્રણથી ઉપર વધવા માંડે છે અને છ યા તેથીઓ ઉપર વધી જય છે, તેમ તેમ તેના પ્રમાણું પ્રમાણું પ્રબળ યાને વધું જેરાવર થતી જય છે અને એવી સુધ્યમ નાશકારક “હરીરી” (microbes) યાને જંતુઓ પેદા કરે છે કે જે બારીક યંત્ર વડે પણ દેખાઈ શકતાં નથી. તેઓ સેજદામાજ જેવાઈ શકતાય છે.

હવે ત્યારે માસીક માંદળીની હાલતમાં જે બદ ‘ખાતર’ યાને વીજળીક આકર્ષણીક શકૃતી (મેળેટીજમ) સાથની ‘હરારત’ યાને ગરમી ખહાર પડે છે તે ખરાબ મેળેટીજમનો વાજળી રીતે અટકાવ નહીં કર્યાથી દરજી-ધ-ખુલ્લનું જેર બહુ વધી જય છે, અને આ દરજનો જેશ એટલો તો ખળવાન હોય છે કે લોંઘતાં દુર એટલી એક ઓરતના ખાખમાં વદીક ત્રણ કદમ યાને મુખેધમાં આશરે સાડાદશ કુટની અંદર આવનાર ગમે તેવા એક પરહેંગાર શાખસના પવીન ખોરેહનો ‘કુતે’ કરી (યાને કાપી) નાંખે છે. તેથીજ દરજી-ધ-ખુલ્લ યાને દર્શાન તથા મનીથી ઉત્પત્ત થતી ખરાબ મેળેટીક અસરો નહીં ઉભી થાય અને આસપાસનાઓને કોઈભી પ્રકારનું નુકસાન નહીં થાય, (જે નુકસાન આગળ ચાલતાં વર્ણવિવામાં આવશે), તેને ખાતર ખાસ એલાહેદાં બેસવા માટે વંદીદાદ પ્રમાણે દરજી-ધ-ખુલ્લ ઉભી કરનાર આવી હાલતવાલી ઓરતને રહેવાને માટે નીચે લોંઘતાં સુઝી નક્કર જમીન (soil) જેધાએ, અને સુઝી નક્કર જમીન હોય તોજ તે ખુલ્લના બદ પ્રવાહને જમીન પોતાની અંદર જેચી કોણે છે, અને જમીન આ જેચેલા બદ પ્રવાહનું પોતાને માટે ખાતર (manure) બનાવી દે છે. નક્કર જમીન માણુસ જતથી યા કોઈભી ખીંદાનું પ્રકારથી ઉભી થતી બદ ‘હરીરી’ને મેળેટાધ્યજ કરે છે યાને પોતા તરફ જેચે છે, અને આ રીતે કોઈભી પ્રકારની અસરે-તારીધીને અસરે-રોશનીમાં ઝેરવી નાંખવાનો ઉમદામાં ઉમદા ગુણું જમીનની શકૃતી “આરમધતી” પોતાના તાખા હેઠળની પેદાયશ એટલે કે જમીનની અંદર

ધરાવે છે. દુર બેસવા માટે અસલ 'આરમેશ્ટ-ગાહુ' યાને ખાસ એવા-હેઠી જચ્છા ઘેરની ખહાર રાખવામાં આવતી હતી પણ આજે તેવી જગ્યા જમાનાની ગીરદેશને લીધે તેમજ ધર્મ તરફની બેદરકારીને લીધે ભળે નહીં, યાને વખત ઘણો ખરાખ થતો આવે છે. માટે કોઈથી પ્રકારની તરીકૃત પાળવા ચાહનારે સૌથી પહેલાં નજ્જર જમીનપર પોતાનો ચાહુ વસ્વાટ રહે તેની તલખ કરવી જોઈએ. નજ્જર જમીન વગર તરીકોનાં પાલનનું પરીશુામ રહ્યાંની વૃદ્ધિમાં ઉત્તરનું નથી. રહ્યાંની વૃદ્ધિને ખાતર ખુદ આપણું રવાને આ તન્દુપી જમીનમાંજ રાલ્યુશીથી વસ્વાટ કર્યો છે,-ના, ખુદ પોતીકા હોવીઅતરથી ભાગને તનના કાદવમાં ફેરવાવી લીધો છે, કે કે તન્દુપી જમીનની ભીલવણી તથા સહકારથીજ-તેના કુમયાથીજ રવાન પોતાની બોખ્તગી (મોક્ષ-મુદ્દિત)ની નેમ પાર પાડી શકશે. બાહ્ય જમીન એ આપણું તન્દુપી જમીનનું Extension છે, કે આપણું રવાનના જનવર-ઝડપાન-ખનીજમાં વહેચાયલાં અંશોની ફેરવાયલી હોવી-અતંની બનેલી છે. કુદરતે રહેલ કરીને આ બાહ્ય જમીનમાં પોતીકું 'ઓરમધતી'ની ભીનોધ ગતિ રેડી દીધો છે, કે જેની બરકતથી યાને જેના સંબંધમાં રહીનેજ ધનસાની રહે તરીકોને પાળી પોતાનાં તનની 'આરમધતી'ની શક્તિને જગાડી રહ્યાંની વૃદ્ધિ કરી શકશે. બાહ્ય જમીન અને આપણું તનની જમીન વચ્ચે આવો ગુહ્ય સંબંધ હોવાને લીધેજ, વંદીદાદની ખાસ એક પરગરદ કેદ જમીન ખુશાલ છે અને કેદ જમીન નાખુશ છે તે બાબત ઉપર રોકવામાં આવી છે.

હવે જે માળ ઉપર દશાનવાળી યા સુવાવડવાળી હાલતમાં એક ઓરત દુર બેસે છે તો માળ ઉપરની કોખા યા ટાઇલની લોયના પાતલા પડુની પછી નીચે હવા સાથના પોકળ પોળાણું ભાગો આવતા હોવાથી તે ઓરતનાં બદનની તે વખતની 'હરારતે-ગરેવીઆ' યાને ખોટી ગરમીનું પ્રમાણું પેલી કોખાની લોયની આકર્ષણું શક્તિ કરતાં ધર્યું વધારે હોવાથી તે ઓરતનાં બદ-મેળેટીજના પ્રવાહને તે કોખાની જમીન ખેચીને ધરતીમાં ગારક કરી શકતી નથી. હવે જે ખરાખ પ્રવાહ માળ ઉપરની ભૌયથી ખેચાઈ શકતો નથી તે "વયુ-ઉપર કુદ્ધર્ય" યાને વાતાવરણ (padding atmosphere) ની હવામાં ચોમેર ફેલાઈ રહે છે, અને જ્યાં તે બદ-મેળેટીજમની 'ઉસુલ' યાને મુળ (centre) દશાનવાળી હાલતમાં ઓરત બેઠલી હોય છે તેને પોતાને તેમજ તે ઓરડામાં રહેનારાંઓને, તથા તે માળની ઉપર તેમજ નીચેના તમામ માણો ઉપરનાં તેમજ લોયતજ્યેનાં લોકોને, અને તે ઘેરની આસપાસની અમુક

હે સુધીની તમાસ હવા દમમાં કેનારાંઓને પેલો બદ્ધ પ્રવાહ પુગી વળી નુકશાન કરે છે. આ દરજી-એ-ખુલ્લની તમામ ‘હરીરી’ (microbes જીણા અણુદીઠ જંતુઓ) ને હવામાં અણુદીઠ રીતે બદ્ધ-પ્રવાહ સાથે ફરતી રહે છે તે અધાં આસપાસનાઓનાં દમમાં જય છે અને તેઓના ઉશ્તાન યાને દમ ચલાવનાર સળવન શકૃતીની સાથે આમેજ થાય છે અને ઉશ્તાનથી ચાલુ જનનું બનતું થતું હોવાથી, અને જન આપણી મન-શક્તિનું મુળ હોવાથી, પછી આસપાસનાઓનાં મનમાં જાતી-દર્શક યાને ગુદ્ધ અંગેને ઉશ્કેરનારા હવસી વિચારો પોતાની મેળે આવવા માટે છે, એટલું નહીં પણ આ ‘હરીરી પુષ્કળ જથ્થામાં દમમાં ગયાથી તથા ચાલુ તે ઘેરમાં હવાનો બગાડ કુર્યાથી ખાસ કરીને તપે-દીક વગરે જતબલતનાં શારીરીક (શરીરને લગતા) કાલેલ દરદો લા ઉભરી નીકળે છે. હાલમાં અધે ઘેરમાં જેશો તો આને કોઈ ભીમાર પડયું તો થોડો વખત ગયા પછી કોઈ ભીજું માંં પડયું એમ વારંવાર નાનાં મોટાં ને સાધારણ ચાલુ ભીમાર પડે છે તેના અનેક કારણોમાં આ દરજી-એ-ખુલ્લથી ઉપર સમજાયા મુજબ ઉપલા હવામાં ચાલુ ભીગાડ થવાનાં કારણે લીધે છે. ‘તપે-દીક’ એ ઝરસી શર્દા (તપ-ધ-દીક) છે અને એનો અર્થ hectic feverાં યાને એક જતની શરીરને ગળાવી નાંખનારી અંદરખાનેની તાપ ને ખાહી જેવા જીવદેશુ રોગ વીજેરેમાં દેખાવ હે છે એમ અર્થ થાય છે. આ “તપે-દીક” ની ભીમારી બહુ ગંભીર જીવદેશુ રોગ ગણ્ય છે. આ ભીમારીથી ખાકી શરીરના સાંધે સાંધા તેમજ તમામ “ગાંથા” યાને શરીરની અંદરના અંગો ઢીલાઢ્ય થઈ બગડી જય છે. એ ભીમારી અણુદીઠ ‘અજ્ઞાદ’ યાને ‘મવાડી’ શરીર ને તમામ રોગન યાને તેલ જેવા અણુદીઠ પદાર્થનું બનેલું હોય છે અને ને ખાકી શરીરના અણાદ પ્રતી-ભીબ (counterpart) સરંબું હોય છે તેમાં ખુદ પેવસ થાય છે, કે ને શરીર સુક્ષમ રોગાની (યાને તરીને લગતાં) આણી અનાસરનું બનેલું હોવાથી તેને “આબે-સુક્ષમ” તરીકે પણ ઓળખે છે, અને ને શરીર સાધારણ આંખે યા સુક્ષમર્દ્દીક યંત્ર વડે પણ જેવાઈ શકતું નથી. આ જલેમ દરદ, આજના દુશ્યાર ગણ્યાતા ડોક્ટરો વિકીક પારખવામાં (diagnose યાને દરદની પરીક્ષા કરવામાં) લુલાનો ખાય છે. એ ‘અજ્ઞાદ’ યાને ‘રોગાની શરીર’ તો ઉશ્તાન યાને બાતેની ખરી સળવન શક્તિ (પ્રાણ) નું ઘેર છે અને ખાકી હૈયાતીનો ખુદ પાયો છે. જેમ કોપરેલની બતીમાંનું તેલ બધું બળી રહ્યા પછી કાકડો કેમ છેલ્લે સંંગવા માંટે છે અને બળીને છેવટે કાકડોખી ખાક થાય છે, તેમ આ ‘અજ્ઞાદ’ ને છંદ-

ગનો કાકડો છે તે પોતે આ ‘તપે-દીક’ ની ભીમારી લાગુ પડે અળવા માટે છે. મરણ વખતે તો આપું ‘અઝદ’નું તમામ રોગન ‘ગચ્છેથા’ યાને શરીરના અંદરના અંગોમાં ચુસાઈ જય છે અને તેથી ‘ગચ્છેથા’ મંદ પરી જવાથી કામ કરતાં એટાં પડે છે અને મરણ વખતે શરીર તદન લીધું બની જય છે. તેટલાજ માટે ‘અઝદ’ ની ભીમારી જે ‘તપે-દીક’નાં સામાન્ય નામે ઓળખાય છે તે કાતેલ ગણ્યાય છે.

હવે જરયોશ્ઠી ઈલ્મે-ક્ષુભ સુજખ માનવીનાં અંધારણની જે નવ વિલાગો છે તેમાંનો એક વિલાગ જે ‘અઝદ’ ને નામે અવસ્તામાં ઓળખાય છે તેને એ ‘તપે-દીક ની કાતેલ ભીમારી કેવી રીતે લાગુ પડે છે તે જોઈશું. આ નવ વિલાગોના અવસ્તા નામો ઝુદાની મેહેરથી યજશનેના પપ માં હામાં નીચે સુજખ જગ્યાવાઈ રહેલાં સામટાં મળે છે:-

(૫) સ્થુળ-હાડેસ ભાગો યાને વખતના વહેવા સાથે વધે અને સંકોચાઈ પણ જય તેવા જહેરી છંદ્રીથી બારીક સાયન્ટીઝીક યંત્રથી પામી શકાય તેવા ભાગો:

(૧) “તત્તુ” યાને ખાકી શરીર જેમાં ‘ગચ્છેથા’ યાને શરીરની અંદરના સાંચાકામના અવયવો સીવાય તમામ બહારનો દેખાઈતો શરીરનો આકાર હાડપીજર-સનાયુઓ સમાઈ જય છે.

(૨) “ગચ્છેથા” યાને શરીરની અંદરના અંગો એટલે અવયવો (vital organs) જેવાં કે દીમાગ યાને મેણું, ફ્રેનસાં, દીલ (યાને હાર્ટ heart), જીવે=નથીર (યાને સેન્ટેન્ની બારીક નસો), લગર યાને કલેણું, તહીં, શેકમ યાને હોનરી, આંતરડાં, ગુસ અંગો તથા ગુરદા વગેરે. તેમજ Ductless glands, sympathetic ganglia વીગેરે.

(૩) “અઝદ” યાને ‘આબે-સુક્મ’ એટલે કે ‘મવાદી’ અણુદીઠ શરીર જે તમામ રોગન યાને તેલ જેવા પણ અતી સુક્મ પદાર્થનું બનેલું છોય છે અને જે ખાકી શરીરના આખાદ પ્રતીષીંબ counterpart સમાન છોય છે.

(૪) “સુક્મ-હાડેસ” ભાગો યાને વખતના વહેવા સાથે વધ-ઘટ પામતા અણુદીઠ ભાગો:

(૪) “કહુર્દી” યાને સુક્મ અનાસરી શરીર જેમાં ઉરવાન અહીંથી રહેલત કર્યા બાદ યાને મરણ બાદ પણ વાસો કરે છે.

(૫) “તેવીધી” યાને વાસના-શક્તિ જેમાંથી અધી ઉંચ કુન્યાંથી ખાહેશ અને લાગળુંઓ તૃપ્યુંએ જરૂર પાડે છે.

(૬) “ઉશ્તાન” યાને આતેન અંદરખાનેની સજ્જવન-શક્તિ (દમ, પ્રાણ) જે જુંગાને ટેકાવી રાખે છે અને લાન કરાવે છે,

(૭) “કદીમ” યાને હમેશના, કદી વધઘટ નહીં પામનારા ભાગો :

(૮) “ઉરવાન” યાને આત્મા (soul) જે હમેશાં “ઉર્ઝ” યાને મીનોધ વૃદ્ધિની ગતીમાં રહે છે.

(૯) “અગ્રોદંગ” યાને મીનોધ શાન, જે તે સાહેખનું લાન કરાવનાર ગતી છે.

(૧૦) “કુવધી” યા ફ્રોહર યાને સૌથી “અતલક્ષમાં અતલક્ષ” (શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ) અંશ; તે સૌથી તુરી પ્રકાશ કે જેનો લાસ દરેક ઉરવાન પોતીકાં બચ્ચોદંગની મારક્ષિત મેળવનાર છે તે. ઉરવાનનું લાન ખીલવી ઉસુલ નેમ જે દાદાર હોરમજનને મળવાની છે તે તરફ લઈ જનાર.

તપે-દીકની ખીમારીની જાહેર નીશાનીઓ (Symptoms) ભરદ્વ ઓરત માટે નીચે સુણય રહે છે:—શરૂઆતમાં લોહી-કુમ ‘અસ્પન્દી’ યાને પ્રમાણમાં રહે છે, જેથી લોહીન ‘અખુલ’ (corpuscles red and white રાતાં અને સફેદ અનુઓ) કુમનેર થાય છે, જેથી શરીરના દરેક સાંધે સાંધામાં કુમનેરી પેદા થાય છે. ગોરે ભાગે કથળજીાત થાય છે કારણું કે જોરાક હજમ કરવાની શકતી મંદ પડે છે. પગનાં તલ્યાંમાં અગન દેખાવ દે છે, ચાલતાં પગ ઉંચકાતા હોય તેમ થાય છે. માથાનો દુખાનો ચાલુ થયા કરે છે, દશ્તાન ઘણું મંદ પડવાથી વધારે જાય છે યા તો થોડું થોડું અન્યાયા કરે છે. જેમ જેમ ‘અઝદ’નું રોગાન સુકાય છે તેમ તેમ ‘શોશર’ યાને મની, ધાત, કમી થતી જાય છે તેમજ તે વારંવાર કવખતે પસાર થવા લાગે છે. ગુણ અંગને કુમનેરી અને નાતવાની લાગુ પડે છે, જેથી સંસારમાં દુખી થાય છે અને જોટી શેહેવત (હવસ)નો વધારો થાય છે અને તેને લીધે ‘ધીનાદ’ યાને જેવાની શક્તિમાં કુમનેરી પેદા થાય છે. મોહડાંપર વખતના વહેવા સાથે દીકાસનું નહેર થણું, શરીરને ગળાવી નાખે તેવી જાતભાતની ડોકટરો વરીકને સમજ નહીં પડે તેવી તરેહવાર તાવોની ખીમારી, તેમજ શકતીનું દીવસે દીવસે ઘટણું, કુખનું મરી જવું, વગેરે વગેરે, દુંકમાં આખાં શરીરમાં રક્તે રક્તે કુમનેરી જાવે છે અને દરેક ગંભેરા યાને

શરીરની અંદરના અવયવો મંદ યાને સુસ્ત પડતા જય છે, જેથી કુંક ઉમરમાં ભુદાપો દેખાવ દે છે અને કંદળી દરેક રીતે ફ્રોક્ટમાં અતમ થાય છે.

તપે-દીકની બીજારીની બાતેની નીશાનીઓ:—‘તપે-દીક’ ની બાતેની અસરો તો એથીણી કાતેલ થાય છે. દર્શા-ધ-યુલની હાલત સંદર્ભ નહી પાઠ્યાથી તથા તેવી હાલતમાં બને જતી એક ઝીજના ચાલુ સમાગમમાં આંધ્યાથી લયંકર પરિણામો અણુદીઠ રીતે ઉત્પન થાય છે:—અરાણ હવસનું ઉશ્કેરાંબું, અનીતીનું વધું, જરાજરામાં ઉશ્કેરાઈ જઈ મારામારીનું ઉત્પન થબું, તરેહનાર ખોટાં નાચ નખરાં, સામી જતીની આગલ દેખાવ (Exhibitionism) કરી તેને ખેચવાની તલબ અને મોજશોખમાં મચ્યા રહેવું, બેહયાપણું યાને બેશરમીપણું થબું, ઉઘોગને બદલે અધાસીપણું થબું, અનુની બનવું, મગજનું સમતોલપણું જતું રહેવું, ખાંસ કરીને દીલ યાને હાઈ અને દીમાગ યાને બેનલનું નબળું થબું, નીચ હલકા હવસી વિચારોનું પેદા થબું, હરામખોરીનું વધું, ઐરાતખોરી યાને કોઈ પાસે ભીખ મંગીને જીવવાની એવ પડવી, જતી સ્વભાવમાં બધી રીતે બીગાડો, શુદ્ધ ખોરેહનું કરે થબું યાને દુર થબું, અશોઈ તરફ તેમજ રોજની બંદળી કરવામાં ‘તેમજ છીયાડામ તરફ લાગણીનું સંદર્ભ નાખું થબું, સાધારણ અકડલહુશીયારીનું ગુમ થબું, કુદરતની પીછાન તરફ ભાનભુલા થબું, લાચારીનું વધું, ઉરવનની જવાબદારી અને વૃદ્ધિના ખ્યાલનું ભુલાઈ જવું, પેસાના પુનરી થબું, બીજા ધર્મોની રાહરસમો અને આચારવીયારો ચુહણું કરવા, આપણા પોતાના દીનધર્મના કાયદાઓને જણીનેદિને હસી કહાડવા, વગેરે વગેરે બનવા પામે છે. કુંકમાંથી સાચ્યું જરથોરતી આખ ગુમ થવા માંડે છે અને અધર્મીપણું કે બેધર્મીપણું વધી પડે છે.

સંદર્ભ દુર બેસવાનું નહી પાળનારી ઓરત પોતાને તેમજ તેના સમાગમમાં આવનાર ભાજુસોને તેમજ કુદરતની પૈદાપશોને કેટલું જાહેરી નુકસાન કરે છે:—દુર બેસવાનું જણીનેદિને સંદર્ભ નહી પાળનાર ઓરત તેવી હાલતમાં પોતાનાં વેરની તમામ ચીજેને પોષાક-સામાનને અડકુને અપ્પવિન કરે છે, તેમજ ઘેરમાનો અનાજ તથા કોઈથી પકાવેલી ખાવપીવાની ચીજે, પાણી, ફળ, ફૂટોને અડકુને તેમાં અણુદીઠ રીતે બીગાડો કરે છે અને તે આવી બગડેલી ચીજે ખાનારને અણુદીઠ રીતે નુકશાન પુગાડે છે. જાડનાં બીયાને અડકે છે તો તે બીયાં ફળદૂપ થતાં નથી, તેમજ જે જાડની કલમો અને રોપા-

ઓને અડકે છે તેઓ સુકાધને નાશ પામે છે, અને ખાવાના અચારને અડકે છે તો તેમાં લુલ પડી અગારી જાય છે. (આ નણ ચીનેથી ખુલ્લું જહેરી સાક્ષાત રીતે પુરવાર થાય છે કે એની હરીરી=જંતુઓ નુકશાનકારક છે). ઘેરના પવિત્ર આતશને અડકુયાથી યા તેને જોવાથી તે આતશના ઓરેહનો નાશ કરે છે, તેમજ આ દર્ઢ-ઈ-ખુલ્લવાળી ઓરત પોતાનાં ઘેરમાંના મરહો તેમજ ભીજાં બધાંઓને અડકે છે અને તેઓને બધંકર નુકસાન અણણીઠ રીતે પુગાડે છે, અને ઘેરમાંના તેજ મરહો તેમજ ભીજાંઓ તેહેવારના પવિત્ર દીવસોપર આતશઅહેરામ, અચ્યારી જેવાં પાક મકાનોમાં જાય છે, જ્યાં લ્યાંના બોયવાળા મોખેદના સમાગમમાં આવે છે, તેમજ કેટલા લાગતાવળગતા બધાંના સમાગમમાં આવે છે, અને આ રીતે તે લોકોનું ઓરેહ અગારી પાક મકાનોને પણ દરેક રીતે નહી લઈ ચલાવી શકાય તેવો મોટો ધોકો પુગાડે છે. આવી ઓરત કદાચ ખુલ્લની હાલતમાં મરણ પામે છે તો તે તેના ઘેરના કોઇને પણ કદાચ માલુમ ન હોવાથી તેની મરણુકીયા પણ જેમ ગમે તેમ થાય છે.

આવી ખુલ્લવાલી ઓરતના સમાગમમાં આવનારા માણસોનાં જેણાંની શકૃતીને ખરાખ અસર પુરે છે અને તેઓની સદખુદ્ધિનું જેર સુધ્યમ યાને બાતેન સમજ શકૃતીની બાધદમાં કુમતર થતું જાય છે અને જરૂરવાદી નાસ્તીક (યાને ખુદાની પીછાણુથી દુર) અફુરતી તરેહવાર ગલત વીચારો અને માની લીધેદી શીલસુદ્ધી તરફ તેઓની મગજશકૃતી ઘણી ચાલાક રહે છે અને ખાસ કરીને ધીમે ધીમે તેઓમાં અધર્માપણું ઘણું વધતું જાય છે.

આવી ખુલ્લવાલી ઓરત ને મકાનોમાં માળ ઉપર બેસ્તી હોય યા આ હાલત સંદર્તર પાળતી ન હોય, તેવાં મકાનોમાં કોઇણી ગુજર પામેલાં રવાનોની મરણ ડીયાઓ આખાં મકાનમાં કેઠેણી દીની કાયદા મુજબ બીલહુલ થાય નહી અને તેવાં ખુલ્લવાલા મકાનમાં કોઇણી અરશનુમયાળા યાઓજદાશ્રેગરથી જવાદ શકાતું નથી, અને જે તે જાય તો તેનું અરશનુમ તદન રદ થાય છે, કારણું કે અરશનુમની મહાન ડીયાથી પોતાનાં ઓરેહની ને પવિત્રાધ તેણે મેળવેલી હોય છે તે એકંકદમ આવી અદ-મેનેટીઝમ યાને ખરાખ પ્રવાહની અસરથી કુપાધ જાય છે, અને તેવાં ખુલ્લવાલાં મકાનમાં જઈ ડીયા કરનાર મોખેદને તેમજ ડીયાકામ જાણુનોએને તેવાં મકાનમાં કરાવનારને બનેને ઘણો મોટો શુનાહ લાગુ પડે છે, કારણું કે ડીયાકામનો અશોધની મારફિતે ને સદજીપયોગ કરવો જોઈએ તે કરવામાં આવતો નથી. ઉલ્લંઘ, પવીત ડીયાકામો અને માંથેને આવી પલીઠી (ખરાણી)માં

નાંખી, કુરતમાં યસ્તન-દરણ ઉભી કરે છે. જે દુર બેસવાનું નીચેનું
પળાતું હોય તો તે જગ્યા નીચે કૃયાકામ થતું હોય ત્યાંથી ઘણી લાંબે
આશરે ૩૦ કુટ દુર હોવી જોઈએ. માળ ઉપર દશતાનવાળી ઓરતના
રહેવાથી આખાં ઘેરની 'અધ્યપી' યાને આસપાસની હવાનો સુક્ષમ ભાગ
કેવો બગડી જય છે તે ભીના ઉપર સમજલી છે તે ધ્યાનમાં લેતાં તે
ઘેરમાં નીચે લોયતજ્યે યા માળ ઉપર અશોધની પવિત્ર મરણ કૃયાકામ
કરાવવાનું કમ્બિક્યુમાટલરેલું લાગે છે, અને આ કારણને લીધેજ લાચારીએ
કૃયાકામ અગ્યારીમાં સોંપવું પડે છે, જે અલબતાં ઘેરમાં થતી કૃયા-
કામ કરતાં ઘણી રીતે ઘણાં કારણોસર ઘણીજ ઓછી અસરકારક યા
નીરમુળ નીવડે છે, કારણું કે કોઈભી ગુજર પામનારની અધ્યપીની હુશમોરદી
કૃયાઓ જે જગાએ તે ગુજર પામનાર રહેતો હોય તેના હુંદુંથનો
વસ્ત્વાટની જગ્યાએજ થવી જોઈએ એવો જરથોશ્ટી દર્શનનો મુળ નિયમ
છે. આ અધ્યપીની કૃયાઓ શું છે અને તે ઘેરમાં નહી કરાવ્યાથી શું
નુકસાન થાય છે તે હવે વીગતે જોઈએ.

- Extract from the book titled: "Zoroastrian Life Procedure Code" - by B. B. Rivetna
(pgs 189-200)